

Thirteen years of seeking justice for the victims of 26/11 Mumbai terror attacks

November 26, 2021

26/11ના મુંબઈ ત્રાસવાદી હુમલાના પીડિતો માટે ન્યાય મેળવવાના તેર વર્ષ

નવેમ્બર 26, 2021

26/11ના મુંબઈ ત્રાસવાદી હુમલાના 13મા વર્ષ નિમિત્તે ભારત સરકાર અને ભારતના લોકોએ તે હુમલાનો ભોગ બનેલા લોકો અને આપણા રક્ષણ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા બહાદુર સુરક્ષાકર્મીઓને યાદ કર્યા હતા.

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ અલગ અલગ સંદેશમાં પીડિતોના પરિવારજનો માટે પોતાની દૃઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મહારાષ્ટ્રની રાજ્ય સરકાર દ્વારા મુંબઈમાં પોલીસ મેમોરિયલ ખાતે એક સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

વિદેશ મંત્રાલયે આજે ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનના એક વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં ઝડપી ટ્રાયલ માટે ભારતની હાકલનું પુનરાવર્તિત કરતી એક નોંધ મૌખિક રીતે અને પાકિસ્તાન સરકારને ભારત વિરુદ્ધ આતંકવાદ માટે તેના નિયંત્રણ હેઠળના પ્રદેશોને મંજૂરી ન આપવાની તેની પ્રતિબદ્ધતાનું પાલન કરવા હાકલ કરતી એક નોંધ તેમને સોંપવામાં આવી હતી.

આ હુમલાઓમાં 14 અન્ય દેશોએ તેમના નાગરિકો ગુમાવ્યા હતા. આ દેશોમાં ભારતીય મિશન રાષ્ટ્રીય અને વિદેશી પીડિતોની યાદમાં સ્મારક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે, જે વિશ્વને આતંકવાદના સતત વૈશ્વિક ખતરાની યાદ અપાવે છે. યજમાન સરકારોના વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ, પીડિતોના પરિવારના સભ્યો અને બચી ગયેલા લોકો આ ગૌરવપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.

તે અત્યંત દુઃખની વાત છે કે આ ઘૂણાસ્પદ આતંકવાદી હુમલાના 13 વર્ષ પછી પણ વિશ્વના 15 દેશોમાંથી 166 પીડિતોના પરિવારો હજી પણ ન્યાય મળવાની રાહ જોઈ રહ્યા છે, પાકિસ્તાને ગુનેગારોને સજા કરવામાં ઓછી ગંભીરતા દર્શાવી છે.

26/11ના આતંકવાદી હુમલાનું આયોજન અને તેનું અમલીકરણ પાકિસ્તાની ભૂમિમાંથી શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાને સ્વીકાર્યું છે કે આતંકવાદીઓને પાકિસ્તાનની ધરતી પરથી મોકલવામાં આવ્યા હતા. અમે ફરી એકવાર પાકિસ્તાન સરકારને તેના બેવડા ધોરણો છોડી દેવા અને ભયાનક હુમલાના ગુનેગારોને ઝડપથી ન્યાયના કઠેડામાં લાવવા માટે હાકલ કરીએ છીએ. આ માત્ર આતંકવાદીઓના હાથે માર્યા ગયેલા નિર્દોષ પીડિતોના પરિવારો પ્રત્યે પાકિસ્તાનની જવાબદારીની બાબત નથી, પણ આંતરરાષ્ટ્રીય જવાબદારી પણ છે.

ભારત સરકાર પીડિતો અને શહીદોના પરિવારોને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરતી રહેશે.

નવી દિલ્હી

નવેમ્બર 26, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.